



POSESSION NOTICE
(For Immovable Property)

Whereas, The undersigned being the Authorised Officer of Bank of Baroda, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a **Demand Notice dated 06.02.2017 calling upon the borrower Shri Pravinbhai Ramabhai Paswan** to repay the amount mentioned in the notices aggregating being **Rs.6,78,818.00 (Rupees Six Lac Seventy Eight Thousand Eight Hundred Eighteen only)** with further interest thereon as mentioned in the notice, till the date of payment and incidental expenses, costs, charges incurred / to be incurred less recovery within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned is in **PHYSICAL possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 and in compliance of Hon'ble D.M. Vadodara order dated 06.12.2019 under section 14 of the said Act, on this the **29th day of AUGUST of the year 2020.**

The Borrower / Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with property will be subject to the charge of the **Bank of Baroda for an amount of Rs. 6,78,818.00 (Rupees Six Lac Seventy Eight Thousand Eight Hundred Eighteen only)** with further interest thereon as mentioned in the notice, till the date of payment and incidental expenses, costs, charges incurred / to be incurred less recovery.


The borrower's attention is invited to the provisions of sub- section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property

All that piece and parcel of property Residential Flat No. 202, Second Floor, Shivalay Flat, admeasuring 855 Sq.Ft., C.S. No. 197, 198, 199, 200 and 205, Mouje Tarsali, Registration District and Sub District Vadodara and bounded: As On or towards East by : Road after Margin, On or towards West by : Flat No.201, On or towards North by : Road, On or towards South by : Flat No.203

Place : Baroda, Date : 29-08-2020

Authorised Officer, Bank of Baroda



AAVAS FINANCIERS LIMITED
(Formerly known as Au HOUSING FINANCE LIMITED) (CIN:L65922RJ2013PLC034297)
Regd. & Corp. Office: 201-202, 2nd Floor, South End Square, Mansarovar Industrial Area, Jaipur. 302020

POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorised Officer of AAVAS FINANCIERS LIMITED (Formerly known as "AU HOUSING FINANCE LIMITED") under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13(12) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice calling upon the borrowers mentioned herein below to repay the amount mentioned in the respective notice within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, undersigned has taken possession of the properties described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 9 of the said rules on the dates mentioned as below. The borrower and guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the property will be subject to the charge of the **AAVAS FINANCIERS LIMITED (Formerly known as "AU HOUSING FINANCE LIMITED")** for an amount mentioned as below and further interest thereon.

Name of the Borrower	Date & Amount of Demand Notice	Description of Property	Date & Type of Possession
Faridmahmad F Malek, Rashidabanu Malek (A/c No.) LNAND02116-170039620	7-Feb-18 Rs. 1951339/- Dues as on 7-Feb-18	Survey No 242/1+2+3/3, Property 14/163/1 Village Antroli, Kapadvanj, Distt- Kheda, Gujarat Admeasuring- 18.58 Sq. Mtr.	Physical Possession Taken on 28-Aug-2020
Ishwarbhai Sindhbhai Patani, Anitaben Patni, Sindhbhai Patni (A/c No.) LNPAT02216-170035707	2-Mar-19 Rs. 828436.41/- Dues as on 1-Mar-19	Revenue Survey No.832, 837, To 839, Block No. 119, Shiv Colony, Gujarat Housing Board, 1a - Patan, Dist. Patan Gujarat Admeasuring- 49.55 Sq. Mtr.	Physical Possession Taken on 28-Aug-2020

Place : Jaipur Date: 01.09.2020 Authorised Officer Aavas Financiers Limited




RFP for Legal Advisor

NSIC Venture Capital Fund Limited (NVCFI) is a wholly owned subsidiary of **The National Small Industries Corporation, a Mini-Ratna Corporation of the Government of India under the Ministry of MSME.** NVCFI is in the process for setting up of Self Reliant India (SRI) Fund, an FoF to be registered as an Alternative Investment Fund.

NVCFI requires services of a reputed Law Firm with experience and expertise in comprehensive handling of assignments relating to AIFs, VCFs, PEs etc. to act as Legal Advisor and assist NVCFI in the entire process and activities related to Fund of Funds (FoF), till the completion of its life.

Indian Law Firms, qualifying the eligibility conditions prescribed in the RFP, may submit their proposals latest by 05:00 PM on 21st September, 2020. The RFP can be downloaded from the website of NSIC (www.nsic.co.in).

Sd/
OSD, NVCFI
Tel: 011-26924510, Email: osd.nvcfl@nsic.co.in



TATA CAPITAL FINANCIAL SERVICES LTD.
Regd Office: 11th Floor, Tower A, Peninsula Business Park, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai-400013.
Branch- 592, 5th Floor Neelgog Square R.B. Mehta Rd, Opp Ghatkopar Rly Station, Ghatkopar(East) Mumbai - 400075

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY
(Under Rule 8(6) of the Security Interest (Enforcement) Rules 2002)
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002
Loan Account No. 7029217 & 8644652 M/s SHIVAM ENTERPRISE

Notice is hereby given to the public in general and in particular to the below Borrower/ Co-Borrower that the below described immovable property mortgaged to Tata Capital Financial Services Ltd. (Secured Creditor), the Possession of which has been taken by the Authorised Officer of Tata Capital Financial Services Ltd. (Secured Creditor), will be sold on 19th September 2020 "As is where is" & "As is what is" and "Whatever there is" for recovery of total sum of **Rs. 3,06,96,313/- (Rupees Three Crore Six Laks Ninety Six Thousand Three Hundred and Thirteen Only)** due as on 1st March 2019 from 1. **M/s. Shivam Enterprise, Through its Partner, & 2. Kunjan Kumar H. Patel & 3. Miraben K. Patel,** R/O Plot No. 21 And 26, Navagam Udhog Nagar, N.H. No. 8, Kamrej Char. Rasta, Tal: Kamrej, Surat, Gujarat- 394185, **Also At** Flat No. B-301, Vasupujya Residency, Opp. Trinity Business Park, Near Madhuvan Circle, Lo Savani Road, Adajan, Surat, Gujarat- 395009, **4. Prashant Maheshbhai Patel,** At A-403, Vasupujya Residency, Opp. Trinity Business Park, Near Madhuvan Circle, LP Savani Road, Adajan, Surat, Gujarat- 395009, **Also At** Plot No. 21 And 26, Navagam Udhog Nagar, N.H. No. 8, Kamrej Char. Rasta, Tal: Kamrej, Surat, Gujarat-394185, **Also At** Flat No. B-301, Vasupujya Residency, Opp. Trinity Business Park, Near Madhuvan Circle, LP Savani Road, Adajan, Surat, Gujarat- 395009, **5. S. Kaushal H Patel,** Panchayat Faliyur, Kholeshtar, Surat, Gujarat- 394180, **Also At,** Plot No. 21 And 26, Navagam Udhog Nagar, N.H. No. 8, Kamrej Char. Rasta, Tal: Kamrej, Surat, Gujarat- 394185, **Also At** Flat No. B-301, Vasupujya Residency, Opp. Trinity Business Park and Near Madhuvan Circle, LP Savani Road, Adajan, Surat, Gujarat- 395009. **The Reserve Price and the Earnest Money Deposit is mentioned below.**

Whereas the sale of secured asset is to be made to recover the secured debt and whereas there was a due of sum of **Rs. 3,06,96,313/- (Rupees Three Crore Six Laks Ninety Six Thousand and Three Hundred Thirteen Only)** including all costs, interest etc. as on 1st March 2019, Notice is hereby given that, in the absence of any postponement/ discontinuance of the sale, the said property shall be sold by E- Auction at 2 P.M. on the said **19th September 2020** by Tata Capital Financial Services Ltd. Having its branch office at **Tata Capital Financial Services Ltd., 502, 5th Floor Neelgog Square, R.B. Mehta Rd, Opp Ghatkopar Rly Station, Ghatkopar (East) Mumbai- 400075.** The sealed E- Auction for the purchase of the property along with EMD Demand Draft shall be received by the Authorized Officer of the TATA CAPITAL FINANCIAL SERVICES LTD till 5 P.M. on the said 18th September 2020. The sale of the property will be in "as is where is condition" and the liabilities and claims attaching to the said property, so far as they have been ascertained, are specified in the Schedule.

Description of Secured Asset	Type of Possession	Reserve Price (Rs)	Earnest Money (Rs)
Property for Loan A/c No. 7029217:- Property No. 1- All Rights, Title & Interest in Non-Agricultural Property Bearing Block No. 156, 157, 158, 159 Paiki Plot No. 21, Total Area Admeasuring 501.72 Sq. Mtrs., Of Village Navagam, At Taluka Kamrej & District Surat. Bounded As: East- 25 Feet Road, West- Plot No. 26, North- Plot No. 20 & South- Plot No. 22. & All Rights, Title & Interest In Non-Agricultural Property Bearing Block No. 156, 157, 158, 159 Paiki Plot No. 26, Total Area Admeasuring 501.72 Sq. Mtrs., Of Village Navagam, At Taluka Kamrej & District Surat. Bounded As: East- Plot No. 27, West- Plot No. 25, North- 25 Feet Road & South- Plot No. 21	Constructive	Rs. 1,19,90,000/- (Rs. One Crore Nineteen Lakhs Ninety Thousand Only)	Rs. 11,90,000/- (Rs. Eleven Lakhs Ninety Thousand Only)
Property for Loan A/c No. 8644652:- Property No. 2- All Rights, Title & Interest in Non-Agricultural Property Bearing Revenue Survey No. 63, Part No. 1, Admeasuring 7386 Sq. Mtrs. And Rs. No. 63 Part No. 3, Admeasuring 809 Sq. Mtrs., PaikiTp No. 31 (Adajan), Fp No. 131 Paiki "Vasupujya Residency" Paiki Building No. "B" Paiki Third Floor, Flat No. 301, Total Area Admeasuring 108.07 Sq. Mtrs. Of Adajan At Taluka Choryashik District. Surat. Bounded As: East- Adjoining Fp No. 129, West- Adjoining Fp No. 132, North- Adjoining Road & South- Adjoining Road	Constructive	Rs. 40,00,000/- (Rs. Forty Lakhs Only)	Rs. 4,00,000/- (Rs. Four Lakhs Only)

The description of the property that will be put up for sale is in the Schedule. The sale will also be stopped by the Authorized Officer if, amount due as aforesaid along with interest, costs, charges and expenses (including the cost of the sale) has been paid Tata Capital Financial Services Ltd. (Secured Creditor), at any time before the date fixed for E-auction or payment proof of the amount of such secured debt, interest, costs, charges and expenses is submitted to the Authorized Officer. At the sale, the public generally is invited to submit their tender personally. No officer or other person, having any duty to perform in connection with this sale shall, however, directly or indirectly bid for, acquire or attempt to acquire any interest in the property sold. The sale shall be subject to the conditions prescribed in the Security Interest (Enforcement) Rules, 2002 and to the following further conditions:

The E-auction will take place through portal <https://disposalhub.com> on **19th September 2020** between 2.00 PM to 3.00 PM with unlimited extension of 10 minutes each.

(1) The particulars specified in the Schedule herein below have been stated to the best of the information of the undersigned, but the undersigned shall not be answerable for any error, misstatement or omission in this proclamation. In the event of any dispute arising as to the amount bid, or as to the bidder, the lot shall at once again be put up to auction.

(2) The property shall not be sold below the Reserve Price. (3) Bid Increment Amount will be Rs. 1,00,000/- (Rupees One Lacs Only). (4) All the Bids submitted for the purchase of the property shall be accompanied by Earnest Money as mentioned above by way of a Demand Draft favoring the "TATA CAPITAL FINANCIAL SERVICES LTD." payable at Surat. The Demand Drafts will be returned to the unsuccessful bidders. (5) The highest bidder shall be declared to be the purchaser of any lot provided always that he is legally qualified to bid and provided further that the amount bid by him is not less than the reserve price. It shall be in the discretion of the "Authorized Officer" to decline acceptance of the highest bid when the price offered appears so clearly inadequate as to make it inadvisable to do so. (6) For reasons recorded, it shall be in the discretion of the "Authorized Officer" to adjourn/ discontinue the sale. (7) Inspection of the property may be done on **11th September 2020 between 11 A.M. to 5 P.M.** (8) The intending bidders should make their own independent inquiries regarding the encumbrances, titles of properties put on auction and claims/rights/dues/affecting the Secured Asset, prior to submitting to their bid. The E-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment of any representation on behalf of TCFSL. The Secured Asset is being sold with all the existing and future encumbrances whether known or unknown to TCFSL. The Authorised Officer of Secured Creditor shall not be responsible in any way for any third party claims/rights/dues. (9) The person declared to be the purchaser shall, immediately after such declaration, deposit twenty-five per cent of the amount of purchase money to the "Authorized Officer" and, in default of such deposit, the property shall forthwith be put up again and resold. (10) The person declared as the successful bidder should bear the charges/fees payable for conveyance such as Stamp Duty, Registration fees, incidental expenses etc. as applicable as per law. The person declared as the successful bidder shall also bear all statutory dues if any, TATA CAPITAL FINANCIAL SERVICES LTD does not undertake any responsibility to procure any permission/license etc. in respect of the secured assets offered for sale. The person declared Successful bidder shall pay all the statutory dues/taxes/charges/fees/housing society property tax/electricity/water, etc., if any. If the intending bidder requires, he should appraise himself about various dues from different organization before bidding. TATA CAPITAL FINANCIAL SERVICES LTD holds no responsibility to provide information about the same. (11) As per Section 194-1A of the Income Tax Act, 1961, TDS @1% will be applicable on the sale proceeds wherein the sale transaction is **Rs. 50,00,000/- (Rupees Fifty Lakhs)** and above. The successful bidder/ purchaser shall deduct 1% TDS from the Sale Price and deposit the same with the Income Tax department in Form. 16B. The TDS payment acknowledgement slip has to be submitted to the Authorised Officer. (12) In case the initial deposit is made as above said, the balance amount of the purchase money payable shall be paid by the purchaser to the "Authorized Officer" on or before the 15th day from the date of confirmation of the sale of the property, exclusive of such day, or if the 15th day be a Sunday or other holiday, then on the first office day after the **15th day** which can be extended post consultation with Authorised Officer in accordance to the SARFAESI Act, as the case may be, but with express consent only. In case of default of payment default of payment within the period mentioned above, the property shall be resold, after the issue of a fresh proclamation of sale and all amounts deposited till then shall be stand forfeited by the TATA CAPITAL FINANCIAL SERVICES LTD and the defaulting purchaser shall forfeit all claims to the property or to any part of the sum for which it may be subsequently sold. The property shall be resold at the discretion of the Authorised Officer. (13) Note: The intending bidders may contact the Authorized Officer **Mr. Munir Kulavoor, Email id Munir.Kulavoor@tatacapital.com and Mobile No. +919322286765.** (14) For detailed terms and conditions of the Sale, please refer to the link provided in secured creditor's website i.e. www.tatacapital.com/tcfsl.html. Sd/
Authorized Officer
(Mr. Munir Kulavoor)
Date: 01/09/2020
Tata Capital Financial Services Ltd.



बैंक ऑफ इंडिया
Bank of India

Head Office, Information Technology Department, C 4, G BLOCK, Star House-2, 8th floor, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai-400 061. E-mail: headoffice@bankofindia.co.in

REQUEST FOR PROPOSAL FOR RATE CONTRACT FOR SUPPLY, INSTALLATION, COMMISSIONING AND MAINTENANCE OF UV CHEQUE SCANNERS FOR CTS ON PAN-INDIA BASIS

The captioned RFP is available on Bank's corporate website www.bankofindia.co.in under "Tender" section since 28-08-2020. Subsequent changes if any, will henceforth be uploaded only on the website. The last date of submission: 23-09-2020



INDIA INFRASTRUCTURE FINANCE COMPANY LIMITED
(A Government Of India Enterprise)
Registered Office: 5th Floor, Block 2, Plate A & B, NBCC Tower, East Kidwai Nagar, New Delhi - 110 023
CIN : U67190DL2006GOI144520

REQUIRES CHIEF GENERAL MANAGER (DIRECT RECRUITMENT)

Post	Mode of Recruitment	Vacancies	Reserved for
Chief General Manager	Direct (Regular)	01	OBC (Backlog)

For complete details and application form, please visit our Website <http://www.iifcl.org> under Recruitment caption. Last date of filling up of application is on or before 15.09.2020

Sd/-
General Manager

THE BARODA RAYON CORPORATION LIMITED
CIN - L99999GJ1958PLC000892
Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220
(T) 0261-2899555 | Email-brcsurat@gmail.com | Website-www.brcil.in

NOTICE OF 60th AGM AND BOOK CLOSURE

NOTICE is hereby given that 60th ANNUAL GENERAL MEETING of the Company will be held on Tuesday, the 29th September, 2020 at 09.00 a.m. at Patidar Bhavan, Kadodara, Surat - 394327 to transact the business as set out in the Notice of the 60th AGM.

Notice is also hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 read with rules framed there under and Regulation 42 of SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Book will remain closed from Wednesday, 23rd September, 2020 to Tuesday, 29th September, 2020 (both day inclusive) for the purpose of Annual General Meeting.

For The Baroda Rayon Corporation Limited
Sd/- Kunjal Desai
Company Secretary
Place: Surat
Date: 31/08/2020

FORM B
PUBLIC ANNOUNCEMENT
(Under Regulation 12 of the Insolvency and Bankruptcy (Liquidation Process) Regulations, 2016)
FOR THE ATTENTION OF THE STAKEHOLDERS OF DHORAJIA ENGINEERING COMPANY PRIVATE LIMITED (In Liquidation)

	DHORAJIA ENGINEERING COMPANY PRIVATE LIMITED (In Liquidation)
1 Name of Corporate Debtor	DHORAJIA ENGINEERING COMPANY PRIVATE LIMITED (In Liquidation)
2 Date of incorporation of Corporate Debtor	11.05.1988
3 Authority Under Which Corporate Debtor is Incorporated/Registered	Registrar of Companies, Gujarat, Dadra and Nagar Haveli
4 Corporate Identity Number / Limited Liability Identity Number of Corporate Debtor	U28199GJ1988PTC010687
5 Address of the Registered Office and Principal Office (if any) of Corporate Debtor	C-25, Trezure Enclave, Nr. Anyaman Bungalow, Thaltej - Shilaj Road, Ahmedabad - 380059.
6 Date of Closure of Insolvency Resolution Process	25.07.2020
7 Liquidation Commencement Date of Corporate Debtor	10.08.2020 (Order Obtained on 28.09.2020)
8 Name and Registration Number of the Insolvency professional acting as Liquidator	KIRAN SHAH Registration No.: IBBI/UPA-001/IP-P00480/2017-18/10868
9 Address, and e-mail of the liquidator, as registered with the Board	Address: 608, Sakar 1, Near Gandhigram Railway Station, Opp. Nehru Bridge, Ashram Road, Ahmedabad-380 009 Email: dhruviks@gmail.com
10 Address, and e-mail to be used for correspondence with the liquidator	Address: As per item 9 above Email: kiranshah.jp@gmail.com
11 Last Date For Submission of Claims	09.09.2020

Notice is hereby given that the Hon'ble National Company Law Tribunal, Ahmedabad has ordered the commencement of liquidation of **M/s. DHORAJIA ENGINEERING COMPANY PRIVATE LIMITED (In Liquidation)** on 10.08.2020, which was obtained by liquidator on 28.08.2020. The stakeholders of **M/s. DHORAJIA ENGINEERING COMPANY PRIVATE LIMITED (In Liquidation)** are hereby called upon to submit their claims with proof or updated claims on or before 09.09.2020, i.e. 30 days from the liquidation commencement date to the liquidator at the address mentioned against item 9. The financial creditors shall submit their claims with proof or update their claims by electronic means only. All other stakeholders may submit claims with proof in person, by post or by electronic means. Submission of false or misleading proof of claim shall attract penalties.

KIRAN SHAH
Date : 28.08.2020 Liquidator for M/s. DHORAJIA ENGINEERING COMPANY PRIVATE LIMITED
Place : Ahmedabad Reg No. IBBI/UPA-001/IP-P00480/2017-18/10868



AU SMALL FINANCE BANK LIMITED
(Formerly known as Au FINANCIER'S (INDIA) LIMITED)
Regd. Office: 19-A, Dhuleshwar Garden, Ajmer Road, Jaipur - 302001 (CIN:L36911RJ1996PLC011381)

APPENDIX IV [SEE RULE 8(II)] POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized Officer of the AU Small Finance Bank Limited (Formerly known as AU Financiers (India) Limited) under the "Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act, 2002 (54 of 2002)] and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice on the date as mentioned below calling upon the borrowers to repay the amount mentioned in the said notice within 60 days from the date of receipt of the said notice as per the details given in below table:-

Name of Borrower/Co-Borrower/ Mortgagee/Guarantor/Loan A/c No.	13(2) Notice Date & Amount	Description of Mortgaged Property	Date of Possession Taken
Kishankumar Maheshkumar Vasvani, Madhu Kishankumar Vasvani, (Loan A/C No.) LSPNR02715-160372733, L9001060100638570	11-Apr-18 ₹ 7,73,897/- Rs. Seven Lac Seventy Three Thousand Eight Hundred Ninety Seven Only as on 10-Apr-18	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Shop No. 9, Out Of Sheet No. 26-B, City Sr. No. 11336 Paiki, 11, "Shakuntal Complex", Taluka Palanpur, Distt. Banaskantha, Gujarat. Admeasuring 16.33 Sq. Mtr. East: Shop No. 10, West: Shop No. 8, North: Wall, South: Common Passage	29-Aug-20
Hiralal Velji Hirani, Smt. Rekhaben Hiralal Hirani, Guarantor: Shri Narayan Beverages, (Loan A/C No.) L9001060713114663	25-Oct-18 ₹ 67,65,451/- Rs. Sixty Seven Lac Sixty Five Thousand Four Hundred Fifty One only as on 25-Oct-18	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Plot No. 2, Gram Panchayat House No. 1/3/51, At Mirzapar, Taluka Bhuj, Distt. Kutch, Gujarat. Admeasuring 222.96 Sq. Mtr.(Builtup Area 146.80 Sq. Mtr.). East: Open Land, West: Road, North: Gamthal Plot No. 1, South: Gamthal Plot No. 3	28-Aug-20
Patramal Karshan Gadhavi, Smt. Madhuri Patramal Gadhavi, (Loan A/C No.) L9001060714029656	20-May-19 ₹ 42,90,329/- Rs. Forty Two Lac Ninety Thousand Three Hundred Twenty Nine Only as on 20-May-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Property On Sub Plot No. 23/24C, Rev. Sr. No. 356, Vill.-Madhpar, Ta.-Bhuj, Dist.-Kutch, Gujarat. Admeasuring 129.87 Sq. Mtr & Built Up Area 162.52 Sq. Mtr. East: 7.62 Mtr. Internal Road, West: Plot No. 18, North: Plot No. 22, South: Sub Plot No. 23-24/B	28-Aug-20
Bhavesb Laxman Ramani, Laxman Tribhuvan Ramani, Smt. Bhawana Bhavesb Ramani, Parakashkumar Laxman Ramani, (Loan A/C No.) LSBHU05916-170439762, L9001060700153002	24-Sep-19 ₹ 21,15,938/- Rs. Twenty One Lac Fifteen Thousand Nine Hundred Thirty Eight only as on 30-Aug-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Property Situated At, Ph No. 31, Survey No. 370/1, Sanskar Nagar, Near Dava, Vill. & Tehsil. Mandvi, Dist. Kutch, Gujarat. Admeasuring 101.25 Sq. Metre. East: Road, West: Plot No 28, North: Plot No 32, South: Plot No 30	27-Aug-20
Bharatkumar Ambalal Patel, Smt. Darshababen Bharatbhai Patel, (Loan A/C No.) LSMEH02713-140241803, L9001060100248363	25-Nov-19 ₹ 2,64,882/- Rs. Two Lac Sixty Four Thousand Eight Hundred Eighty Two only as on 19-Nov-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Property No. 5/86, Dist. Mehsana, Gujarat. Admeasuring 111.02 Sq. Metre. East: Road, West: House Of Nathubhai Shankarbhai, North: Road, South: House Of Kantibhai Ishwarbhai Patel	27-Aug-20
Ramjibhai Nathubhai Vadecha, Smt. Badhaben Nirasi Ramjibhai Vadecha, (Loan A/C No.) LSPNT02716-170453188, L9001060100673316	25-Nov-19 ₹ 2,80,536/- Rs. Two Lac Eighty Thousand Five Hundred Thirty Six only as on 19-Nov-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Residential Plot At Survey No. 439, Plot No. 98, Radhanpur, Dist. Patan, Gujarat. Admeasuring 135 Sq. Mtr. East: Boundary Of Plot No 115, West: 6.00 Mtr Wide Road, North: Boundary Of Plot No 99, South: Boundary Of Plot No 97	26-Aug-20
Sureshkumar Goparamji Prajapati, Smt. Dariyaben Sureshkumar Prajapati, (Loan A/C No.) LSPNR05915-160392341, L9001060700653041	19-Dec-19 ₹ 3,56,202/- Rs. Three Lac Fifty Six Thousand Two Hundred Two only as on 18-Dec-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Plot No. 991, Kren Vas, Ughmani Sheri Jagdara, Vill. & Th. -Palapur, Dist.-Banaskantha, Gujarat. Admeasuring 24.15 Sq. Mtr. East: Internal Road, West: Adj House, North: Open Land, South: Adj House	29-Aug-20
Rajnikanthbhai Mafatlal Jani, Smt. Manishababen Rajnikant, (Loan A/C No.) L9001060113132952	19-Dec-19 ₹ 4,69,822/- Rs. Four Lac Sixty Nine Thousand Eight Hundred Twenty Two only as on 18-Dec-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Survey No. 83, Grond Floor, Colony Dantivada, Dist- Banaskantha, Gujarat. Admeasuring 9.47 Sq. Mtr. East: Road, West: Shop No-11, North: Gallery & Shop, South: Shop	28-Aug-20
Jayantibhai Narottamdas Patel, Smt. Ramlaben Jayantilal Patel, (Loan A/C No.) LSMEH02714-150256875, L9001060100249816	19-Dec-19 ₹ 8,31,871/- Rs. Eight Lac Thirty One Thousand Eight Hundred Seventy One only as on 18-Dec-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Commercial Plot No 1, Survey No-3275, Gokul Chambers, Siddhraj Road, Siddhpur, Dist-Patan, Gujarat. Admeasuring 23.40 Sq. Mtr. East: Shop No-2, West: Road, North: Main Siddhraj Road, South: Shop No-3	27-Aug-20
Rashminbhai Vishnuprasad Soni, Smt. Rekhaben Rashminbhai Soni, (Loan A/C No.) LSMEH02714-150260121, L9001060100249936	19-Dec-19 ₹ 3,76,814/- Rs. Three Lac Seventy Six Thousand Eight Hundred Fourteen only as on 18-Dec-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Commercial Plot No-F/17, Survey No-26/A/1, Mega Plaza, Nr Panchmukhi Hanuman, Dist-Patan, Gujarat. Admeasuring 13.80 Sq. Mtr. East: Common Passage, West: Road, North: Adj. Shop No-F --16, South: Adj. Shop No-F -18	26-Aug-20
Hareshkumar Valajibhai Prajapati, Smt. Narmadaben Hareshbhai Prajapati, (Loan A/C No.) LSDSEE02716-170486511, L9001060100599222	19-Dec-19 ₹ 9,99,472/- Rs. Nine Lac Ninety Nine Thousand Four Hundred Seventy Two only as on 18-Dec-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Phn-4, Survey No-118, Surya Nagar, Umiya Nagar Society, Deesa, Dist-Banaskantha, Gujarat. Admeasuring 83.64 Sq. Mtr. East: Lagu Sis No 4063, West: Lagu Sis No 4063 /B 4, North: Road, South: Compound	28-Aug-20
Prakashbhai Dhudabhai Darji, Smt. Kamalaben Prakashbhai Darji, (Loan A/C No.) L9001060113476785	19-Dec-19 ₹ 3,13,960/- Rs. Three Lac Thirteen Thousand Nine Hundred Sixty only as on 18-Dec-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Milkat No. 15, Draji Vas, Mouje Delvada, Deodra, Dist. Banaskantha, Gujarat. Admeasuring 42.75 Sq. Mtr. East: House Of Ranchhodbhai, West: House Of Mykeshbhai, North: House Of Nathubhai, South: Road	27-Aug-20
Ratilal Manilal Nayi, Smt. Ramlaben Ratilalbhai Nai, Guarantor: Gandaji Gamnaji Thakor, (Loan A/C No.) LSPNT02716-170514886, L9001060100676852	19-Dec-19 ₹ 2,82,831/- Rs. Two Lac Eighty Two Thousand Eight Hundred Thirty One only as on 18-Dec-19	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Plot No-2/177, Block-2, Nayi Vas, Vagddo, B/H Dudeshwari Temple, The & Dist-Patan, Gujarat. Admeasuring 41.82 Sq. Mtr. East: Road, West: Road, North: House Of Jyantibhai Nai, South: Road	26-Aug-20
Dineshbhai Bhembabhai Suthar, Smt. Naynaben Dineshbhai Suthar, (Loan A/C No.) L9001060113134518	17-Jan-20 ₹ 4,85,203/- Rs. Four Lac Eighty Five Thousand Two Hundred Three Only as on 16-Jan-20	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Residential Plot At Suthar Vas, Sinad, Nr Gram Panchayat, Tehsil-Radhanpur, Dist-Patan 385340 Gujarat. Admeasuring 69.71 Sq. Mtr. East: Road, West: House, North: Road, South: House	26-Aug-20
Jetsibhai Shankarbhai Mali, Smt. Okhiben Jetsibhai Mali, (Loan A/C No.) LSPNR02715-160325520, L9001060100635064	17-Jan-20 ₹ 3,72,259/- Rs. Three Lac Seventy Two Thousand Two Hundred Fifty Nine Only as on 16-Jan-20	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Plot No-6 Paiky, Virkrupa Soc, Three Hanuman Road, Village & Tehsil-Deesa, Dist-Banaskantha 385535 Gujarat. Admeasuring 73 Sq. Mtr. East: Plot No 6 Paiky, West: Plot No 5, North: Plot No 90 Paiky, South: Internal Road	28-Aug-20
Dilipkumar Bhikhabhai Chaudhary, Smt. Ramaben Bhikhabhai Bhutadiya, (Loan A/C No.) LSPNR02715-160362775, L9001060100638050	11-Feb-20 ₹ 6,98,858/- Rs. Six Lac Ninety Eight Thousand Eight Hundred Fifty Eight Only as on 11-Feb-20	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Plot No. 6, Gram Panchayat Property No. 869, At Sim Of Timbachudi, Ta - Vadgam, Dist.-Banaskantha, Gujarat. Admeasuring 62.70 Sq.Mtrs. (Built Up Area 41.80 Sq. Mtr.) East: Anganbadi, West: Open Land, North: Road, South: Adjoining Wall Of House Of Kamrajibhai Heerabhai	29-Aug-20
Mukeshkumar Bhagvanbhai Daraji, Smt. Lalitaben Mukeshbhai Daraji, Bhagvanbhai Madhabhai Daraji, (Loan A/C No.) LSDERO2716-170463998, L9001060100612464	17-Feb-20 ₹ 4,26,047/- Rs. Four Lac Twenty Six Thousand Forty Seven Only as on 14-Feb-20	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Situated At Commercial Plot No-307, Rangoli Complex, Bhabar, Village-Deodar, Dist-Banaskantha 385410 Gujarat. Admeasuring 19.16 Sq. Mtr. East: Jain Samji Vadi, West: Road, North: Shop No 307, South: Shop No 307	27-Aug-20

The borrower having failed to repay the amount, therefore notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein above mentioned table in exercise of powers conferred on him/her under section 13(4) of the said [Act] read with Rule 8 of the said rule on the date mentioned in the above table.

"The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the AU Small Finance Bank Limited (Formerly known as AU Financiers (India) Limited) for the amount and interest thereon mentioned in the above table.

Sd/-
Date : 31/08/2020
Place : Ahmedabad
Authorised Officer AU Small Finance Bank Limited

